



# TITAANIUM TEN ENTERPRISE LTD.

.YARN TO FABRIC TO FASHION

L52100GJ2008PLC055075

5<sup>th</sup> September, 2019

To,  
**BSE Limited,**  
Phirozen Jeejeebhoy Towers,  
Dalal Street  
Mumbai - 400 001, Maharashtra.

**Scrip ID/Code: TITAANIUM / 539985**

**Sub: Newspaper Advertisement for Notice of 11<sup>th</sup> Annual General Meeting, Book Closure and E-Voting**

Dear Sir/Madam,

Pursuant to the provisions of Regulation 30 and 47 of SEBI (Listing Obligation and Disclosures Requirements) Regulations 2015, please find enclosed herewith the copy of advertisement published in newspapers on 4<sup>th</sup> September, 2019 relating to Notice of the 11<sup>th</sup> Annual General Meeting, Book Closure and E-voting information given to shareholders.

Kindly consider the same and take on record.

Thanking you,

**For TITAANIUM TEN ENTERPRISE LIMITED**

**ANKITA RAJ BHIKADIA**

ACS NO.: 48772

Company Secretary & Compliance Officer



**Encl : Copies of Newspaper**



# CORRIGENDUM TO THE DETAILED PUBLIC STATEMENT DATED JUNE 5, 2019 WITH RESPECT TO THE OPEN OFFER TO THE PUBLIC SHAREHOLDERS OF

## INTERNATIONAL PAPER APPM LIMITED

Registered Office: Rajahmundry - 533 105, East Godavari District, Andhra Pradesh, India  
Telephone: +91 883 2471831; Facsimile: +91 883 2461764; Website: www.ipappm.com

OPEN OFFER FOR ACQUISITION OF UP TO 99,42,510 (NINETY NINE LAKHS FORTY TWO THOUSAND FIVE HUNDRED AND TEN ONLY) FULLY PAID UP EQUITY SHARES, HAVING FACE VALUE OF INR 10 (INDIAN RUPEES TEN ONLY) EACH ("EQUITY SHARES"), REPRESENTING 25% (TWENTY FIVE PERCENT ONLY) OF THE VOTING SHARE CAPITAL OF INTERNATIONAL PAPER APPM LIMITED ("TARGET COMPANY"), FROM THE ELIGIBLE PUBLIC SHAREHOLDERS OF THE TARGET COMPANY BY WEST COAST PAPER MILLS LIMITED PURSUANT TO AND IN COMPLIANCE WITH REGULATIONS 3(1) AND 4 AND OTHER APPLICABLE REGULATIONS OF THE SECURITIES AND EXCHANGE BOARD OF INDIA (SUBSTANTIAL ACQUISITION OF SHARES AND TAKEOVERS) REGULATIONS, 2011 AS AMENDED FROM TIME TO TIME ("SEBI SAST REGULATIONS") AT A PRICE OF INR 452.60 (INDIAN RUPEES FOUR HUNDRED FIFTY TWO AND SIXTY PAISA ONLY) PER EQUITY SHARE ("OFFER PRICE"), PAYABLE IN CASH IN ACCORDANCE WITH THE PROVISIONS OF SEBI SAST REGULATIONS ("OFFER/OPEN OFFER")

This Corrigendum is being issued by ICICI Securities Limited, the manager to the Offer ("Manager"/"Manager to the Offer"), for and on behalf of the Acquirer in respect of the Offer to the eligible public shareholders of the Target Company, pursuant to revisions/amendments in the schedule of activities relating to the Offer.

This corrigendum should be read in continuation of and in conjunction with the detailed public statement dated June 5, 2019 ("DPS"), unless otherwise specified.

This Corrigendum is being issued pursuant to changes/amendments in the schedule of major activities relating to the Open Offer and the Offer Price as disclosed in the draft letter of offer dated June 13, 2019 ("DLoF"), in terms of the Securities and Exchange Board of India ("SEBI") letter dated August 7, 2019 bearing reference no. SEBI/HO/CFD/DCR-1/OW/P/2019/151/1 conveying comments on the DLoF and SEBI letter dated August 26, 2019 bearing reference no. SEBI/HO/CFD/DCR1/OW/P/2019/21942/1 granting extension of time to proceed with the Open Offer related formalities pending receipt of approval from Competition Commission of India.

This Corrigendum is being issued in all the newspapers in which the DPS was published.

Capitalized terms used but not defined in this Corrigendum shall have the same meaning assigned to such terms in the Draft Letter of Offer, unless otherwise defined.

### 1. Statutory and other approvals:

In case of delay in receipt or non-receipt of any statutory approvals disclosed in paragraph 7 of the DLoF then in accordance with Regulation 18(11) of the SEBI SAST Regulations, SEBI may, if satisfied that non-receipt of approvals was not due to any wilful default or negligence on the part of the Acquirer, grant an extension for the purpose of completion of the Open Offer subject to the Acquirer agreeing to pay interest to the validly tendering shareholders at such rate as may be specified by SEBI. Where the statutory approvals extend to some but not all the shareholders, the Acquirer will have the option to make payment of the consideration to such shareholders in respect of whom no statutory approvals are required in order to complete this Open Offer. In this regard, SEBI has vide its letter no. SEBI/HO/CFD/DCR1/OW/P/2019/21942/1 dated August 26, 2019 has permitted the commencement of the Tendering Period not later than 12 (twelve) Working Days from the date of receipt of the CCI Approval. As required under the SEBI Extension Letter, the Manager to the Offer has on August 27, 2019, intimated the Stock Exchanges about the receipt of the SEBI Extension Letter. Further, as required by the SEBI Extension Letter, the Offer Price would be paid together with interest computed at the rate of 10 percent per annum on the Offer Price from September 25, 2019 (being the date for completion of payment of consideration calculated in accordance with the SEBI SAST Regulations from the date of receipt of the SEBI Observation Letter) till October 11, 2019 (being the date of the actual payment to the Eligible Public Shareholders who successfully tender their Equity Shares in the Offer). The interest computed at 10 percent per annum on the Offer Price over such period is INR 1.97 (One Rupee and Ninety Seven Paise only) per Equity Share.

### 2. Details of Firm Financial Arrangements:

- (a) The total consideration for the Offer, assuming full acceptance of the Offer i.e. for the acquisition of up to 99,42,510 (Ninety Nine Lakhs Forty Two Thousand Five Hundred and Ten only) Equity Shares at the Offer Price of INR 452.60 (Indian Rupees Four Hundred Fifty Two and Sixty Paise only) per Equity Share, is INR 449,99,80,026 (Indian Rupees Four Hundred and Forty Nine Crore Ninety Nine Lakhs Eighty Thousand and Twenty Six only) ("Maximum Consideration").
- (b) The Acquirer has confirmed that it has adequate financial resources to meet the obligations under the Offer. The Acquirer, the Manager and ICICI Bank Limited, a banking corporation incorporated under the laws of India, acting through its branch office at Capital Markets Division, 1st Floor, 122, Mistry Bhavan, Dinshaw Vachha Road, Backbay Reclamation, Churchgate, Mumbai ("Escrow Bank"), have entered into an escrow agreement dated May 29, 2019 for the purpose of the Offer ("Escrow Agreement"). Pursuant to the Escrow Agreement and in compliance with Regulation 17(1) of the SEBI SAST Regulations the Acquirer has opened an escrow account named "WCPML-IPAPMML-OPEN OFFER ESCROW ACCOUNT" (the "Escrow Account") bearing account number 000405119526. The Acquirer has made a cash deposit of a sum of INR 112,49,95,011 (Indian Rupees One Hundred and Twelve Crores Forty Nine Lakhs Ninety Five Thousand and Eleven only) in the Escrow Account ("Cash Escrow") which is an equivalent to 25% (Twenty Five percentage) of the value of the Maximum Consideration. The Manager is duly authorised by the Acquirer to realise the value of the Escrow Account and operate the Escrow Account in terms of the SEBI SAST Regulations.

### 3. The Public Shareholders are requested to kindly note the following revisions/amendments in the schedule of major activities relating to the Offer:

The revised schedule of activities pertaining to the Offer is set out below:

Name of Activity	Original schedule of activities (Day and Date)	Revised schedule of activities (Day and Date)
Date of Public Announcement (PA)	Wednesday, May 29, 2019	Wednesday, May 29, 2019
Date of publishing of the DPS in the newspapers	Thursday, June 6, 2019	Thursday, June 6, 2019
Last date for filing of the Draft Letter of Offer with SEBI	Thursday, June 13, 2019	Thursday, June 13, 2019
Last date for public announcement of the competing offer(s) as per the first detailed public statement*	Thursday, June 27, 2019	Thursday, June 27, 2019
Last date for receipt of the SEBI observations on the Draft Letter of Offer (in the event SEBI has not sought clarifications or additional information from the Manager to the Offer)	Thursday, July 4, 2019	Wednesday, August 7, 2019**
Identified Date#	Monday, July 8, 2019	Tuesday, August 27, 2019
Last date by which the Letter of Offer is to be dispatched to the Eligible Public Shareholders, whose name appears on the register of members on the Identified Date	Monday, July 15, 2019	Wednesday, September 4, 2019***
Last date for upward revision of the Offer Price and/or Offer Size	Thursday, July 18, 2019	Monday, September 9, 2019
Last date by which the committee of the Independent Directors of the Target Company shall give its recommendation to the Eligible Public Shareholders of Target Company for this Offer	Thursday, July 18, 2019	Monday, September 9, 2019
Date of publication of Offer Opening Public Announcement in the newspapers in which the DPS was published	Friday, July 19, 2019	Wednesday, September 11, 2019
Date of Commencement of the Tendering Period (Offer Opening Date)	Monday, July 22, 2019	Thursday, September 12, 2019
Date of Closure of the Tendering Period (Offer Closing Date)	Friday, August 2, 2019	Wednesday, September 25, 2019
Last date of communicating the rejection/acceptance and completion of payment of consideration for accepted tenders or return of unaccepted/rejected Equity Shares	Tuesday, August 20, 2019	Friday, October 11, 2019
Last date for filing of final report with SEBI	Tuesday, August 27, 2019	Friday, October 18, 2019

\* There was no competing offer to the Acquirer's Offer.

\*\*Actual date of receipt of SEBI's final observation in relation to the Draft Letter of Offer

\*\*\* Being seventh Working Day from the date of receipt of CCI Approval.

#The Identified Date is only for the purpose of determining the names of the Eligible Public Shareholders of the Target Company as on such date to whom the Letter of Offer would be sent. It is clarified that all the Eligible Public Shareholders of the Target Company (registered or unregistered), are eligible to participate in this Offer at any time during the Tendering Period.

Note: The above dates wherever they appear in the DPS should be read accordingly.

### 4. Other Information:

- All other terms and conditions of the Open Offer as set out in the DPS and/or in the DLoF remain unchanged
- The Acquirer accept full responsibility for the information contained in this Corrigendum to the DPS and also the obligations of the Acquirer as laid down in the SEBI SAST Regulations and subsequent amendments thereof.
- This Corrigendum to the DPS will also be available on SEBI's website at www.sebi.gov.in

#### MANAGER TO THE OFFER



ICICI SECURITIES LIMITED

SEBI Regn. No.: INM00011179

ICICI Centre, H.T. Parekh Marg, Churchgate, Mumbai - 400020, Maharashtra, India

Tel: +91 22 2288 2460, Fax: +91 22 2282 6580, Email ID: ipappm.openoffer@icicisecurities.com

Contact Person: Rupesh Khant/Arjun A Mehrotra

Signed for and on behalf of West Coast Paper Mills Limited

Sd/-

Shree Kumar Bangur

Chairman and Managing Director

Place : Mumbai  
Date : September 3, 2019

#### MAYURBHANJ TRADES & AGENCIES LIMITED

CIN: L24117WB1979PLC032322  
REGISTERED OFFICE: 7, WATERLOO STREET, 2ND FLOOR, KOLKATA - 700069  
PHONE: +91-33-2248 0602; E-MAIL: INFO.MAYURBHANJ@GMAIL.COM  
WEBSITE: WWW.MAYURBHANJTRADES.IN

NOTICE IS HEREBY GIVEN that the 40th Annual General Meeting (AGM) of the Company will be held on Thursday, September 26, 2019, at 11.30 A.M. at the Registered Office of the Company at 7, Waterloo Street, 2nd Floor, Kolkata - 700 069, to transact the business as mentioned in the Notice of AGM sent along with the Audited Financial Statements of the Company for the year ended March 31, 2019, and the Board's Report and Auditors Report thereon. Electronic transmission and physical dispatch of the Annual Report, 2019, along with the AGM Notice, Attendance Slip and Proxy Form, have been completed on September 3, 2019. The Notice of AGM is also available on the website of Central Depository Services (India) Limited (CDSL), i.e. www.evotingindia.com. Notice is further given that the Company is providing electronic voting facility from a place other than the venue of AGM (remote e-voting) to the members to exercise their votes on all the resolutions set forth in the Notice of AGM. The company has engaged CDSL for providing e-voting facility. The details of remote e-voting are given below.

- The remote e-voting will commence on Monday, September 23, 2019 from 9.00 A.M. and ends on Wednesday, September 25, 2019 till 5.00 P.M. The e-voting module shall be disabled for voting thereafter, and no one shall be allowed to vote electronically after September 25, 2019 (5:00 P.M.).
- The voting rights of Members shall be in proportion to their share of the paid-up share capital of the Company as on the cut-off date i.e. September 19, 2019.
- Notice of AGM has been sent to all the members whose names appeared in the Register of Members/Beneficial Owners as on August 2, 2019. Any person who acquires equity shares of the Company and becomes a Member after August 2, 2019, and holding shares as on the cut-off date i.e. September 19, 2019, may obtain the Login ID and Password by sending a request at info.mayurbhanj@gmail.com, or call at Tel: +91-33-2248 0602. Once a vote is cast by the Member, he shall not be allowed to change it subsequently.
- The facility of casting vote through ballot paper will be made available at the AGM and the eligible members attending the AGM shall be able to cast their vote at AGM through ballot paper.
- The Members who cast their vote by remote e-voting may also attend the AGM but shall not be entitled to cast their vote again.

In case of any queries pertaining to e-voting, members may refer to the Frequently Asked Questions (FAQs) and e-voting user manual for members available at the Downloads section of www.evotingindia.com or contact Mr. Mehboob Lakhani, CDSL, 17th Floor, Phiroze Jeejeebhoy Towers, Dalal Street Fort, Mumbai - 400001, at email: helpdesk.evoting@cdslindia.com or in Telephone No.: 022-22725040.

NOTICE IS ALSO HEREBY GIVEN that pursuant to Section 91 of the Companies Act, 2013, that the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Friday, September 20, 2019 to Thursday, September 26, 2019 (both days inclusive).

For Mayurbhanj Trades & Agencies Limited  
Sd/-  
(Salya Narayan Ashopa)

Whole-time Director & CFO  
(DIN - 00379772)

Place: Kolkata  
Date: 03-09-2019

#### TITANIUM TEN ENTERPRISE LIMITED

(CIN: L52100GJ2008PLC055075)  
Registered Office: Shop No. 901/914, Rajhans Complex, 9th Floor, Ring Road, Surat-395002, Gujarat  
Email: kapadiatraders@gmail.com Phone: 0261-2320240  
Website: www.titaniumten.co.in

#### Notice of the 11<sup>th</sup> Annual General Meeting of the Company Book closure & E-voting Information

NOTICE is hereby given that 11<sup>th</sup> Annual General Meeting (AGM) of the members of the Titanium Ten enterprise Limited will be held on Friday, 27<sup>th</sup> September, 2019 at 3:00 p.m. at the Registered Office of the Company situated at Shop No. 901/914, Rajhans Complex, 9<sup>th</sup> Floor, Ring Road, Surat-395002, Gujarat to transact the business mentioned in the Notice of the Meeting sent along with the Explanatory Statement, Directors' Report, Auditor's Report and Audited Financial Statements of the Company for the financial year ended 31<sup>st</sup> March, 2019.

The Annual Report containing the Notice, Attendance Slip and Proxy Form has been sent on Tuesday, the 3<sup>rd</sup> September, 2019 to all the Members whose names appear on the Register of the Company as on Friday, the 30<sup>th</sup> August, 2019, whose e-mail addresses are not made available and to those who have opted for receiving physical copies and by e-mail to Members, whose e-mail IDs are registered with the Depository Participants/Company. The Notice of AGM is also available on the website of the Company www.titaniumten.co.in and copies of the said documents are also available for inspection at the Registered Office of the Company between 10.00 a.m. to 1.00 p.m. on all working days, except on holidays, up to and including the date of the Annual General Meeting of the Company.

Notice is further given that pursuant to provisions of Section 91 of the Companies Act, 2013 read with applicable rules and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from 19<sup>th</sup> September, 2019 to 27<sup>th</sup> September, 2019 (both days inclusive).

Notice is further given that pursuant to Section 108 of the Companies Act, 2013, Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing electronic voting facility from a place other than the venue of AGM (remote e-voting) provided by CDSL, on all the Resolutions set forth in the Notice. The details of remote e-voting are given below:

- The remote e-voting will commence on Tuesday, the 24<sup>th</sup> September, 2019 at 9:00 a.m. and ends on Thursday, the 26<sup>th</sup> September, 2019 at 5:00 p.m. The e-voting module shall be disabled for voting thereafter.
- The voting rights of Members shall be in proportion to their Shares of the Paid-up Share Capital of the Company as of the Friday, 20<sup>th</sup> September, 2019.
- Any person who acquires Equity Shares of the Company and becomes a Member after dispatch of the Notice and holding shares as of the Friday, 20<sup>th</sup> September, 2019, may obtain the login ID and password by sending a request at helpdesk.evoting@cdslindia.com or kapadiatraders@gmail.com vote is cast by a Member, he/she shall not be allowed to change it subsequently.
- The Members who cast their vote by remote e-voting may also attend the AGM but shall not be entitled to cast their vote again.

In case of any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions (FAQs) and e-voting manual available at www.evotingindia.com under help section or write an email to helpdesk.evoting@cdslindia.com.

For Titanium Ten Enterprise Limited  
Sd/-  
Ankita Raj Bhakadia

Place: Surat  
Date: 03/09/2019  
Company Secretary & Compliance Officer

#### Justdial®

#### JUST DIAL LIMITED

CIN: L74140MH1993PLC150054

Registered Office: Palm Court Bldg M. 501/B, 5<sup>th</sup> Floor, New Link Road, Besides Goregaon Sports Complex, Malad (West), Mumbai - 400 064.  
Tel: +91 22 2888 4060; Fax: +91 22 2889 3789  
Email: investors@justdial.com; Website: www.justdial.com

#### NOTICE

Notice is hereby given that the Twenty Fifth Annual General Meeting ("AGM") of Just Dial Limited (the "Company") will be held on Monday, September 30, 2019 at 3.30 P.M. at Magnolia Banquet, Sarovar Grand Homestay, Mird Space, Chincholi Bunder, Behind Inorbit Mall, Off New Link Road, Malad (West), Mumbai - 400064 to transact Ordinary and Special business as specially mentioned in the Notice of the said meeting which has been dispatched to the Members whose names appear in the Register of Members on Friday, August 23, 2019 as received from the depositories through (a) electronic mail whose email IDs are registered in the records of depository participants as on Friday, August 23, 2019 and (b) physical mode whose email IDs are not registered with depositories at their registered address.

As per Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended, Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Secretarial Standards on General Meetings (SS-2) issued by the Institute of Company Secretaries of India, the Company is providing to its Shareholders the facility to cast their vote through voting by electronic means. Members may cast their vote either by remote e-voting or through Ballot Paper at AGM on all the resolutions set forth in the Notice. The details as required pursuant to the provisions of the Companies Act, 2013 and Rules framed thereunder are given here under:

1	Date of completion of sending of Notices	September 3, 2019
2	Date and time of commencement of remote e-voting by electronic means	Thursday, September 26, 2019 at 9.00 a.m. (IST)
3	Date and time of end of remote e-voting by electronic means	Sunday, September 29, 2019 at 5.00 p.m. (IST)
4	Cut-off date	Monday, September 23, 2019
5	Voting through electronic means by remote e-voting shall not be allowed beyond this date and time	Sunday, September 29, 2019 5.00 p.m. (IST)
6	The Notice of 25 <sup>th</sup> AGM and Annual Report for the Financial Year 2018-19 are available on the Website of the Company and Karvy Fintech Private Limited ("Karvy").	www.justdial.com https://evoting.karvy.com
7	Contact details of the person responsible to address the grievance connected with the voting by electronic means:	Name: Mr. Rajendra Prasad V Designation: Manager-Registrar in Securities (Karvy) Add: Karvy Selenium Tower B, Plot No. 31 & 32, Gachibowli, Financial District, Nanakramguda, Serilingampally, Hyderabad - 500 032. Tel: +91 40 67161510/12 Email ID: rajendra.v@karvy.com

A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the Depositories as on the cut-off date i.e. Monday, September 23, 2019 shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the AGM. Members may attend the meeting even after casting their votes by remote e-voting but shall not be entitled to cast their votes again.

The facility for voting at the AGM shall be made available by way of Ballot Paper and members attending the meeting who have not cast their vote by remote e-voting shall be able to vote at the AGM by Ballot Paper.

Any person who becomes member after the dispatch of the Notice of the AGM and holding shares as on the cut-off date i.e. Monday, September 23, 2019 may obtain the User ID and password by sending a request at evoting@karvy.com. The procedure for obtaining User ID and password is also provided in the Notice of the AGM which is available on the Company's website and Karvy's website.

All documents referred to in the Notice and Annual Report are open for inspection at the Registered Office of the Company on all working days except Saturdays, Sundays and other Public holidays, between 11.00 a.m. to 1.00 p.m. up to the date of AGM.

By Order of the Board of Directors  
For Just Dial Limited

Sd/-

Date : September 3, 2019  
Place : Mumbai  
Manan Udani  
Company Secretary

#### RSWM LIMITED

CIN: L17115RJ1960PLC008216  
Registered Office: Khanigram, P.O. Gulabpura-311021, Dist. Bhilwara, Rajasthan  
Phone: +91-1483-223144-223150, 223478, Fax: +91-1483-223361, 223479  
Corp. Off: Bhilwara Towers, A-12, Sector-1, Noida-201301, (U.P.)  
Phone: +91-120-4390300 (EPABX), Fax: +91-120-4277841, E-mail: rswm.investor@rajbhilwara.com, Website: www.rswm.in

#### NOTICE

Notice is hereby given that the Company has received the request from the following Transferee(s) relating to transfer of shares in physical mode in terms of SEBI Circular No. SEBI/HO/MIRSD/DOS3/CIR/P/2018/139 dated 6th November, 2018.

Folio No.	Share Certificate No.	Distinctive From	Nos. To	No. of Shares	Name(s) of Holder(s)/ Transferor(s)	Name(s) of Transferee(s)
M0000045	C-31699	11358473	11358502	30	MOHIBAI K. CHAUD MANCHANDANI & RAJKUMARI LALCHAND LAHEJA	MANISH SHAH

In case any person has any claim(s) in respect of the said shares in favour of the above stated applicant(s), he/she/it should lodge his/her/their claim(s) or objection(s) within 30 days from the date of publication of this notice. If within 30 days from the date of publication of this notice, no claim is received by the Company in respect of the said shares, transfers will be effected post completion of said period of 30 days after due verification of documents.

By Order of the Board for RSWM LIMITED

Surender Gupta

Company Secretary

FCS : 2615

Place : Noida (U.P.)

Dated : 3<sup>rd</sup> September, 2019

#### THE HIGHLAND PRODUCE COMPANY LIMITED

CIN: U01119KL1925PLC000416  
Registered Office: W-21/674, Beach Road, Alappuzha - 688012  
avt.alapuzha@gmail.com, www.highlandproduce.com  
Tel: 0477-2243624, 2243625

#### NOTICE TO SHAREHOLDERS

NOTICE is hereby given that the NINETY THIRD Annual General Meeting (AGM) of the Company will be held at 11.30 A.M. on Wednesday, the 25<sup>th</sup> September, 2019 at the Registered Office of the Company at W-21/674, Beach Road, Alappuzha-688012 to transact the Business, as set out in the Notice of AGM. The Company completed the dispatch of Annual Report for 2018-19 along with the Notice of the AGM on 31<sup>st</sup> August, 2019. The Annual Report along with the Notice of the NinetyThird AGM is available on the company's website, www.highlandproduce.com and also on the website of CDSL, www.evotingindia.com.

In compliance with Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, Members are provided with the facility to cast their votes on all resolutions set forth in the Notice of the AGM using electronic voting system from a place other than the venue of the AGM (remote e-voting), provided by Central Depository Services (India) Limited (CDSL) and the business may be transacted through such voting.

The e-voting period commences on 22<sup>nd</sup> September, 2019, Sunday (9.00 a.m. IST) and ends on 24<sup>th</sup> September, 2019, Tuesday (5.00 p.m. IST), after which voting shall not be allowed. During this period, Members may cast their vote electronically. The e-voting module shall be disabled by CDSL thereafter.

The voting rights of Members shall be in proportion to the equity shares held by them in the paid up equity share capital of the Company as on 18<sup>th</sup> September, 2019 (cut-off date).

The facility for voting through polling paper shall also be made available at the AGM and Members who have not already cast their vote by remote e-voting shall be able to exercise their right at the AGM. The Members who have cast their vote by remote e-voting prior to the AGM may attend the AGM but shall not be entitled to cast their vote again.

Persons who have acquired shares and become members of the Company after despatch of the Notice of the AGM but before the cut-off date may use any of the following:

- Use their 8 digits DP ID followed by 8 digits Client ID for National Securities Depository Limited (NSDL) for shares in Demat form and Folio Number for Physical Shares as their Login ID and their PAN as Password. For Central Depository Services (India) Limited (CDSL), use 16 digits Beneficiary ID.
  - Members who have already registered for remote e-voting can however use their existing Login ID and password for this purpose.
  - Others may send an e-mail to investor@cameoindia.com for obtaining Login ID and password for remote e-voting.
- The Register of members of the Company will remain closed from 19<sup>th</sup> September, 2019 to 25<sup>th</sup> September, 2019 (both days inclusive) during which period no transfer of shares will be registered.

A person whose name is recorded in the Register of Members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting as well as voting in the AGM.

For details relating to remote e-voting, please refer to the Notice of the AGM. In case of queries with regard to e-voting, kindly contact Mr. Manu P Sam, General Manager (Finance), The Highland Produce Company Limited, Door No. 27/1032, Panampilly Nagar, Cochin-682036 or e-mail at helpdesk.evoting@cdslindia.com.

By Order of the Board for The Highland Produce Company Limited

Dilip Thomas

Chairman

Chennai

3<sup>rd</sup> September, 2019

pvp

#### PICTUREHOUSE MEDIA LIMITED


CIN: L82191TN2000PLC044077  
Reg. Office: KRM Centre, 9<sup>th</sup> Floor, Door No. 2, Harrington Road, Chennai-600031, Tamil Nadu.  
Corp. Office: Plot No. 83 & 84, 4<sup>th</sup> Floor, Punniath Plaza, Road No. 2, Banjara Hills, Hyderabad - 500 034, Telangana  
E-mail ID: ir.telephoto@pvpglobal.com; Website: www.pvpcinema.com

#### NOTICE OF 20<sup>th</sup> ANNUAL GENERAL MEETING, E-VOTING INFORMATION AND BOOK CLOSURE

Notice is hereby given that:

- The 20<sup>th</sup> Annual General Meeting ("20th AGM") of the Company will be held on Friday, September 27, 2019 at 11.30 a.m. at Sri P. Obul Reddy Hall, Vani Mahal, No. 103, G N Road, T. Nagar, Chennai - 600 017, Tamil Nadu.
- Electronic copies of the Notice of the 20<sup>th</sup> AGM and the Annual Report of the Company for the financial year 2018-19



**SAMTEX FASHIONS LIMITED**  
CIN: L17112UP1993PLC022479  
Regd. Office: Plot No.163, Udyog Vihar, Greater Noida, 201306, Distt. Gautam Buddha Nagar, U.P  
Website: [www.samtexfashions.com](http://www.samtexfashions.com), EMAIL: [samtex.compliance@gmail.com](mailto:samtex.compliance@gmail.com)

**NOTICE OF ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING INFORMATION AND BOOK CLOSURE**

NOTICE is hereby given that the 26<sup>th</sup> Annual General Meeting (AGM) of the members of Samtex Fashions Limited will be held on Tuesday the 24<sup>th</sup> day of September 2019 at Rajdhani Party Lawn, Khassara No. 228, opp. Pathway Shikhar, Village Hazipur, Sector-104, Noida, Gautam Buddha Nagar UP 201304 at 10:00 A.M. to transact the business set out in the Notice along with the Annual Report of the Company for the Financial Year 2018-19, which has already been sent to the shareholders individually through e-mail and post as applicable.

Notice is further given that pursuant to the provision of Section 91 of the Companies Act, 2013 read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 42 & 47 of SEBI (Listing Obligations Disclosure Requirements) Regulations, 2015 the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Wednesday, 18<sup>th</sup> September, 2019 to Tuesday, 24<sup>th</sup> September, 2019 (both days inclusive).

As per Section 108 of the Companies Act, 2013 read with the Rule 20 of the Companies (Management & Administration) Rules, 2014 as amended and Regulation 44 of SEBI (Listing Obligations Disclosure Requirements) Regulations, 2015, the Company is pleased to provide remote e-voting facility to the Shareholders for transacting the business at the above said AGM scheduled to be held on 24<sup>th</sup> September, 2019. Members holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date (record date) of Tuesday, 17<sup>th</sup> September, 2019 may cast their vote electronically on the Business as set out in the Notice of the 26<sup>th</sup> AGM through electronic voting system of Central Depository Services Limited. All the members are informed that:


- (a) The business as set out in the Notice of 26<sup>th</sup> AGM may be transacted by remote electronic voting and ballot paper;
- (b) The voting through electronic means shall commence on Saturday, 21<sup>st</sup> September, 2019 at 10:00 A.M. and end on Monday, 23<sup>rd</sup> September, 2019 at 5:00 P.M.
- (c) Voting through electronic means shall not be allowed beyond 5:00 P.M. on 23<sup>rd</sup> September, 2019;
- (d) Any person, who acquire share of the Company and become member after the dispatch of Notice of AGM and holding shares as of Cut-off date i.e., 17<sup>th</sup> September, 2019 can follow the process of generation of Login ID and password;
- (e) The Notice of 26<sup>th</sup> AGM is available on the Company website [www.samtexfashions.com](http://www.samtexfashions.com) or visit CDSL website [www.evotingindia.co.in](http://www.evotingindia.co.in).
- (f) A member may participate in the general meeting even after exercising his vote through remote e-voting but shall not be allowed to vote again in the meeting;
- (g) In case of queries members may refer to or contact Ms. Kamini Gupta, Company Secretary & GM Finance of the Company, and e-mail ID: [samtex.compliance@gmail.com](mailto:samtex.compliance@gmail.com), Phone No. 011-49025972, who will also address the grievances connected with the electronic voting.

By Order of the Board  
For Samtex Fashions Limited

Sd/-  
(Kamini Gupta)  
Company Secretary & GM Finance

Place : New Delhi

Date : 03.09.2019

**SBI**


Enterprise & Technology Architecture (E & T) Department,  
State Bank Global IT Centre, CBD Belapur, Navi Mumbai - 400 614.

**CORRIGENDUM-IV**

Please refer RFP No SBI/GITC/Enterprise and Technology Architecture/2019/2020/61 dated 23/07/2019 for "Procurement, installation, setup and maintenance of Enterprise Architecture (EA) tool". **Corrigendum-IV** is available under 'Procurement News' at Bank's website, <https://bank.sbi>

**Place:** Navi Mumbai  
**Date:** 04.09.2019

Sd/-  
Head (E & T)

**THE TRAVANCORE-COCHIN CHEMICALS LIMITED**  
(A GOVERNMENT COMPANY), Post Bag No. 4004, Udyogamandal P.O., Kochi- 683501, Kerala, Phone: 0484 -2546515, 2545016, 2546289  
e-mail: [purchase@tccckerala.com](mailto:purchase@tccckerala.com), Visit Web Site : [www.tccckerala.com](http://www.tccckerala.com)

**E - TENDER**

Invited E-tender of the following through <http://etenders.kerala.gov.in>  
All relevant details, the tender document and corrigendum if any can be downloaded from the above site.

Sl No.	Tender ID	Description
1.	2019_TCCL_295663_1	SITC of cross flow type 1000 m <sup>3</sup> /hr capacity cooling tower
2.	2019_TCCL_295602_1	Fabrication, Rubber lining & supply of Brine filter

Sd/-  
Assistant General Manager (Materials)

Date: 03.09.2019

**KPL International Limited**  
(CIN : U23209DL1974PLC029068)  
Registered Office : 212A, 216 & 222, 2<sup>nd</sup> Floor, 'Indraprakash',  
21, Barakhamba Road, New Delhi-110001  
Phone No : +91 11 43579200, Fax : +91 11 23717203  
Website : [www.kplintl.com](http://www.kplintl.com), Email - [info@kplintl.com](mailto:info@kplintl.com)

**NOTICE**

Notice is hereby given that KPL International Limited ("the Company") would be transferring all shares in respect of which dividend has remained unpaid or unclaimed for consecutive seven years or more to the Investor Education and Protection Fund (IEPF), pursuant to Section 124(6) of the Companies Act, 2013 read with Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 (IEPF Rules). The said shares correspond to the shareholders who have not claimed dividend for the F.Y. 2011-12 and for any subsequent years consecutively for seven years or more.

Notice is further given that the Company has already sent specific communication to the latest available addresses of the shareholders whose dividends are lying unclaimed for the last seven (7) consecutive years or more, inter alia, providing the details of shares being transferred to IEPF.

Further in terms of Rule 6(3) of the (IEPF Rules), the statement containing the full details of name, address, folio number and number of equity shares due for transfer is made available on our website for information and necessary action by the shareholders. The web-link to the same is <http://www.kplintl.com/images/IEPF2019.pdf>.

For further information or to claim the unpaid/unclaimed dividend, concerned shareholders may contact the Registrar & Share Transfer Agent: RCMC Share Registry Private Limited, B-25/1, 1<sup>st</sup> Floor, Okhla Industrial Area, Phase-11, New Delhi-110020, Tel No. +91 11 26387320, Fax: +91 120 2444346, E-mail: [shares@rcmcdclhi.com](mailto:shares@rcmcdclhi.com) or Ms. Payal Gugliani, Company Secretary at the Registered Office of the Company.

The concerned shareholders are requested to claim their unclaimed/unpaid dividend amount (s), failing which the shares in respect of which the dividends are lying unpaid/unclaimed for the last seven (7) consecutive years or more will be transferred to the IEPF Suspend on completion of 3 months from the date of the advertisement as per the applicable provisions of IEPF Rules. It may also be noted that all subsequent corporate benefits that may accrue in relation to the above shares will also be credited to the said IEPF Suspend Account.


In case the concerned shareholders wish to claim the shares after transfer to IEPF, a separate application has to be made to IEPF Authority in Form IEPF-5, as prescribed under the IEPF Rules and the same is available at IEPF website, [www.iefpf.gov.in](http://www.iefpf.gov.in).

For KPL International Limited

Sd/-  
Surinder Kumar Kak  
Managing Director  
DIN: 00044521

Place : New Delhi

Date : 04.09.2019

**ગુજરાત આલ્કલીક એન્ડ કેમિકલ્સ લિમિટેડ**  
(આઈએસ-આઈએસઓ પ્રમાણિત કંપની) (ગુજરાત સરકાર દ્વારા પ્રમાણિત)  
રજી.ઓ. : પી.ઓ.પેટ્રોકેમિકલ્સ-૩૯૧૩૪૬, જિ. : વડોદરા, ગુજરાત, ભારત.  
ફોન નં. : ૨૬૧-૨૬૫-૨૨૨૬૪૮-૧-૨  
વેબસાઈટ : [www.gacil.com](http://www.gacil.com)  
CIN : L24110GJ1973PLC002247

**વાર્ષિક સામાન્ય સભા, ઈ-મટદાનની માહિતી તથા સભાસદોનું રજીસ્ટર અને શેર ટ્રાન્સફર બુક્સ બંધ રાખવા અંગેની નિવેદિ**  
(સને ૨૦૧૩ના કંપની દારની કલમ ૯૧, ૧૦૧ અને ૧૦૮ તથા કંપનીના (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ ૨૦૧૪ના રૂલ્સ ૧૦, ૧૮ અને ૨૦ અને સુધારેલ કંપનીના (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ ૨૦૧૫ની અંતર્ગત) આથી સુચિત કરવામાં આવે છે કે ગુજરાત આલ્કલીક એન્ડ કેમિકલ્સ લિમિટેડના સભાસદોની ૪૪મી વાર્ષિક સામાન્ય સભા, શુક્રવાર, તાર.૨૪મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે, કંપનીના સંકુલમાં, પી. ઓ. પેટ્રોકેમિકલ્સ-૩૯૧ ૩૪૬, જિલ્લો: વડોદરા ખાતે નીચે દર્શાવેલ કાર્યસૂચીની બહાલી આપવા યોજવામાં આવેલ છે.

**સાધારણ કામગીરી :**  
(૧) (i) તા. ૩૧મી માર્ચ, ૨૦૧૯ના રોજનું સરવૈયું તથા તે તારીખે પૂરા થયેલા વર્ષના નફા-નુકસાન ખત્રક સહિતના તા. ૩૧મી માર્ચ, ૨૦૧૯ના રોજ પૂરા થયેલા વર્ષના કંપનીના ઓડિટ થયેલા નાણાકીય ખત્રકો તેમજ (ii) તા. ૩૧મી માર્ચ, ૨૦૧૯ના રોજ પૂરા થયેલા વર્ષના કંપનીના ઓડિટ થયેલા સંયુક્ત નાણાકીય ખત્રકો અને ફિક્સેટરોના બોર્ડનો અહેવાલ તથા ઓડિટરના અહેવાલને સ્વીકૃત્તવા અને મંજૂરી આપવા. (૨) તા. ૩૧મી માર્ચ, ૨૦૧૯ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષનું ઇકવિટી શેર પરનું ફિલિડેન્ડ જાહેર કરવા. (૩) શ્રી અરવિંદ અગવાલ, આઈ.એ.એસ. (ડી.આઈ.એસ. ૨૦૧૫-૨૨૬૪૮-૧) વારી પ્રમાણે નિયુક્ત થાય છે અને પુનઃ નિમણૂક માટે લાગુકાર ધરાયે છે તેથી તેઓની પુનઃ નિમણૂક કરવા. (૪) મેસર્સ ડે.સી. મહેતા એન્ડ કું. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ, વડોદરા (ફર્ન રજિસ્ટ્રેશન નંબર ૧૦૨૨૩૭૫) ની કંપનીના રજીસ્ટ્રેશન ઓફિસર તરીકે ૪૪મી વાર્ષિક સામાન્ય સભાના અંતર્ગત ૫૫મી વાર્ષિક સામાન્ય સભાના અંત સુધી એટલે કે પાંચ વર્ષ માટેની નિમણૂક કરવા અને તેઓનું મહેતાદાનું નક્કી કરવા.

**ખાસ કામગીરી :**  
(૫) શ્રી એસ. બી. ડેંગયાની (ડી. આઈ. એન. ૦૧૫૭૪૫૪૫) કંપનીના ઇન્ડિપેન્ડન્ટ ફિક્સેટર તરીકે તા. ૯મી ઓગસ્ટ, ૨૦૧૯ના રોજથી પાંચ વર્ષ માટે નિમણૂક કરવા છે જેઓ વારી પ્રમાણે નિયુક્ત થવાવાનું રહેશે નહીં. (૬) ડૉ. રાજીવ આઈ. મોદીની (ડી. આઈ. એન. ૦૧૩૯૪૫૫૮) કંપનીના ઇન્ડિપેન્ડન્ટ ફિક્સેટર તરીકે તા. ૧લી ઓક્ટોબર, ૨૦૧૯ના રોજથી પાંચ વર્ષ માટે પુનઃનિમણૂક કરવા છે જેઓ વારી પ્રમાણે નિયુક્ત થવાવાનું રહેશે નહીં અને (૭) કોસ્ટ એડીટરોના નાણાકીય વર્ષ ૨૦૧૮-૨૦ના મહેતાદાનને બહાલી આપવા. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના ૪૪મી વાર્ષિક અહેવાલ સહિતની નિવેદિ કંપનીની વેબસાઈટ [www.gacil.com](http://www.gacil.com) ના 'ઇન્વેસ્ટર્સ' (Investors) સેક્શનમાં દર્શાવેલ છે અને જે કાઉન્ટોલ કરવા માટે ઉપલબ્ધ છે. સભાની કાર્યસૂચીના કાળોની વિગતોના સંબંધિત દસ્તાવેજો કંપનીની રજીસ્ટર્ડ ઓફિસમાં કામગીરીના કલાકો દરમિયાન બધાજ કાર્કાચી દિવસોએ (શનિવાર અને રવિવાર સિવાય) નોટીસમાં જણાવેલ સમય મુજબ અને સભાની તારીખ સભાના સમય સુધી સભાસદોની બહાલીમાં માટે ઉપલબ્ધ છે.

વધુમાં કંપની દ્વારા ૨૦૧૩ની કલમ ૧૦૮ તથા કંપનીના (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ, ૨૦૧૪ના રૂલ ૨૦ અને સુધારેલ કંપનીના (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) રૂલ્સ ૨૦૧૫ અને તેની (લીસ્ટીંગ ઓર્ગેનાઈઝેશન એન્ડ ફિક્સેટરસ રીલેવાયન્સ) રૂલ્સ ૨૦૧૫ના રજીસ્ટ્રેશન-૪૪ અંતર્ગત, કંપનીએ પોતાના સભાસદોને સભાના સ્થળ સિવાય ઈ-વોટિંગની સુવિધા ("ઈ-વોટિંગ"ની) ઉપલબ્ધ કરાવી છે. તાર.૨૪મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ("ફસ્ટ ઓફ તારીખ")ના રોજ જેઓના નામ સભાસદો / લાભાર્થી માલિકો તરીકે રજીસ્ટરમાં દર્શાવેલા હશે તેઓ ઇલેક્ટ્રોનિક પ્રણાલી દ્વારા નિવેદામાં જણાવેલ કામગીરીના કરવા માટે સી.ડી.એસ.એલ.ની વેબસાઈટ <https://www.evotingindia.com> દ્વારા રી-મોટર ઈ-વોટિંગ કરી શકશે. જે સભાસદોએ રીમોટ ઈ-વોટિંગ દ્વારા વોટિંગ કરેલ હશે તેઓ સભામાં હાજર રહી શકશે પછા સભામાં ફરીથી વોટિંગ કરી શકશે નહીં. ઈ-વોટિંગની પ્રક્રિયા અને વિગતવાર સૂચનાઓ ૪૪મી વાર્ષિક સામાન્ય સભાની નિવેદિના નોંધના ક્રમાંક નં.૧૪માં દર્શાવેલ છે જે કંપનીની વેબસાઈટ [www.gacil.com](http://www.gacil.com) પર ઉપલબ્ધ છે.

આથી, આ સંદર્ભમાં સભાસદોએ નોંધ લેવી કે (૧) કંપનીએ ૪૪મા વાર્ષિક અહેવાલની સાથે સામાન્ય સભાની નિવેદિ દાન કંપની દ્વારા, ૨૦૧૩ની કલમ ૧૦૨ અવધવાના નિવેદન સહિત તા. ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ કુલિયેલ દ્વારા બધા સભાસદોને તેમના નોંધાયેલ સરનામે મોકલાવેલ છે. (૨) જે સભાસદોના ઈ-મેઈલના સરનામા કંપની અથવા તે કોમ્પ્યુટરીઝી પાર્ટિસિપન્ટ્સ (DPs) પાસે નોંધાયેલ છે તેઓએ કંપનીએ ૪૪મી વાર્ષિક અહેવાલ ઈ-મેઈલ દ્વારા મોકલી આપેલ છે. (૩) ઈ-વોટિંગની મદદાન (રીમોટ ઈ-વોટિંગ) મંબળવાર, તાર.૨૪મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના સવારે ૯-૦૦ વાગ્યાથી (ભારતીય સમાનુસાર) મુજાવર, તાર.૨૪મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના સાંજના ૫-૦૦ વાગ્યા (ભારતીય સમાનુસાર) સુધી ફરી. (૪) ઈ-વોટિંગ તાર.૨૪મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના સાંજના ૫-૦૦ વાગ્યા પછી થઈ શકશે નહીં. (૫) જે વ્યક્તિના નામ કસ્ટ-ઓફ તારીખે તેવાર કરેલ સભાસદોના રજીસ્ટરમાં અથવા તે કોમ્પ્યુટરીઝીના લાભાર્થી માલિકોના રજીસ્ટરમાં નોંધાયેલ હશે તેઓ ૪ મોટર ઈ-વોટિંગ અથવા વાર્ષિક સામાન્ય સભામાં વોટિંગ કરવાને હક્કદાર રહેશે. (૬) ૪૪મી વાર્ષિક સામાન્ય સભાની નિવેદિ સીડીએસએલની વેબસાઈટ <https://www.evotingindia.com> પર પણ ઉપલબ્ધ છે.

જે વ્યક્તિઓએ સભાની નોટીસ મોકલવા કે કંપનીના રોજ ખરીદેલ હશે અને તાર.૨૦મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ કંપનીના સભાસદ હશે તેઓ Login ID અને પાસવર્ડ [helpdesk.evoting@cdslindia.com](mailto:helpdesk.evoting@cdslindia.com) પરથી મેળવી શકશે.

જેઓ ઈ-વોટિંગ બાબતે કોઈ જાણકારી મેળવી શકે અથવા તે કોઈ સવાલ હોય તેઓ <https://www.evotingindia.com> ની સાઈટના 'હેલ્પ સેક્શન' હેઠળના Frequently Asked Questions (FAQs) નો સંદર્ભ લઈને ઈ-વોટિંગ મેન્યુઅલ મેળવી શકશે અથવા તે [helpdesk.evoting@cdslindia.com](mailto:helpdesk.evoting@cdslindia.com) ને ઈ-મેઈલ કરી શકશે.

કંપની દ્વારા ૨૦૧૩ની કલમ ૯૧ તથા તેની (લીસ્ટીંગ ઓર્ગેનાઈઝેશન એન્ડ ફિક્સેટરસ રીલેવાયન્સ) રૂલ્સ ૨૦૧૫ના રજીસ્ટ્રેશન-૪૪ અંતર્ગત, કંપનીએ પોતાના સભાસદોને સભાના સ્થળ સિવાય ઈ-વોટિંગની સુવિધા ("ઈ-વોટિંગ"ની) ઉપલબ્ધ કરાવી છે. તાર.૨૪મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ કુલિયેલ દ્વારા બધા સભાસદોને તેમના નોંધાયેલ સરનામે મોકલાવેલ છે. (૨) જે સભાસદોના ઈ-મેઈલના સરનામા કંપની અથવા તે કોમ્પ્યુટરીઝી પાર્ટિસિપન્ટ્સ (DPs) પાસે નોંધાયેલ છે તેઓએ કંપનીએ ૪૪મી વાર્ષિક અહેવાલ ઈ-મેઈલ દ્વારા મોકલી આપેલ છે. (૩) ઈ-વોટિંગની મદદાન (રીમોટ ઈ-વોટિંગ) મંબળવાર, તાર.૨૪મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના સવારે ૯-૦૦ વાગ્યાથી (ભારતીય સમાનુસાર) મુજાવર, તાર.૨૪મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના સાંજના ૫-૦૦ વાગ્યા (ભારતીય સમાનુસાર) સુધી ફરી. (૪) ઈ-વોટિંગ તાર.૨૪મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના સાંજના ૫-૦૦ વાગ્યા પછી થઈ શકશે નહીં. (૫) જે વ્યક્તિના નામ કસ્ટ-ઓફ તારીખે તેવાર કરેલ સભાસદોના રજીસ્ટરમાં અથવા તે કોમ્પ્યુટરીઝીના લાભાર્થી માલિકોના રજીસ્ટરમાં નોંધાયેલ હશે તેઓ ૪ મોટર ઈ-વોટિંગ અથવા વાર્ષિક સામાન્ય સભામાં વોટિંગ કરવાને હક્કદાર રહેશે. (૬) ૪૪મી વાર્ષિક સામાન્ય સભાની નિવેદિ સીડીએસએલની વેબસાઈટ <https://www.evotingindia.com> પર પણ ઉપલબ્ધ છે.

જે વ્યક્તિઓએ સભાની નોટીસ મોકલવા કે કંપનીના રોજ ખરીદેલ હશે અને તાર.૨૦મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ કંપનીના સભાસદ હશે તેઓ Login ID અને પાસવર્ડ [helpdesk.evoting@cdslindia.com](mailto:helpdesk.evoting@cdslindia.com) પરથી મેળવી શકશે.

જેઓ ઈ-વોટિંગ બાબતે કોઈ જાણકારી મેળવી શકે અથવા તે કોઈ સવાલ હોય તેઓ <https://www.evotingindia.com> ની સાઈટના 'હેલ્પ સેક્શન' હેઠળના Frequently Asked Questions (FAQs) નો સંદર્ભ લઈને ઈ-વોટિંગ મેન્યુઅલ મેળવી શકશે અથવા તે [helpdesk.evoting@cdslindia.com](mailto:helpdesk.evoting@cdslindia.com) ને ઈ-મેઈલ કરી શકશે.

કંપની દ્વારા ૨૦૧૩ની કલમ ૯૧ તથા તેની (લીસ્ટીંગ ઓર્ગેનાઈઝેશન એન્ડ ફિક્સેટરસ રીલેવાયન્સ) રૂલ્સ ૨૦૧૫ના રજીસ્ટ્રેશન-૪૪ અંતર્ગત, કંપનીએ પોતાના સભાસદોને સભાના સ્થળ સિવાય ઈ-વોટિંગની સુવિધા ("ઈ-વોટિંગ"ની) ઉપલબ્ધ કરાવી છે. તાર.૨૪મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ કુલિયેલ દ્વારા બધા સભાસદોને તેમના નોંધાયેલ સરનામે મોકલાવેલ છે. (૨) જે સભાસદોના ઈ-મેઈલના સરનામા કંપની અથવા તે કોમ્પ્યુટરીઝી પાર્ટિસિપન્ટ્સ (DPs) પાસે નોંધાયેલ છે તેઓએ કંપનીએ ૪૪મી વાર્ષિક અહેવાલ ઈ-મેઈલ દ્વારા મોકલી આપેલ છે. (૩) ઈ-વોટિંગની મદદાન (રીમોટ ઈ-વોટિંગ) મંબળવાર, તાર.૨૪મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના સવારે ૯-૦૦ વાગ્યાથી (ભારતીય સમાનુસાર) મુજાવર, તાર.૨૪મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના સાંજના ૫-૦૦ વાગ્યા (ભારતીય સમાનુસાર) સુધી ફરી. (૪) ઈ-વોટિંગ તાર.૨૪મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના સાંજના ૫-૦૦ વાગ્યા પછી થઈ શકશે નહીં. (૫) જે વ્યક્તિના નામ કસ્ટ-ઓફ તારીખે તેવાર કરેલ સભાસદોના રજીસ્ટરમાં અથવા તે કોમ્પ્યુટરીઝીના લાભાર્થી માલિકોના રજીસ્ટરમાં નોંધાયેલ હશે તેઓ ૪ મોટર ઈ-વોટિંગ અથવા વાર્ષિક સામાન્ય સભામાં વોટિંગ કરવાને હક્કદાર રહેશે. (૬) ૪૪મી વાર્ષિક સામાન્ય સભાની નિવેદિ સીડીએસએલની વેબસાઈટ <https://www.evotingindia.com> પર પણ ઉપલબ્ધ છે.

જે વ્યક્તિઓએ સભાની નોટીસ મોકલવા કે કંપનીના રોજ ખરીદેલ હશે અને તાર.૨૦મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ કંપનીના સભાસદ હશે તેઓ Login ID અને પાસવર્ડ [helpdesk.evoting@cdslindia.com](mailto:helpdesk.evoting@cdslindia.com) પરથી મેળવી શકશે.

જેઓ ઈ-વોટિંગ બાબતે કોઈ જાણકારી મેળવી શકે અથવા તે કોઈ સવાલ હોય તેઓ <https://www.evotingindia.com> ની સાઈટના 'હેલ્પ સેક્શન' હેઠળના Frequently Asked Questions (FAQs) નો સંદર્ભ લઈને ઈ-વોટિંગ મેન્યુઅલ મેળવી શકશે અથવા તે [helpdesk.evoting@cdslindia.com](mailto:helpdesk.evoting@cdslindia.com) ને ઈ-મેઈલ કરી શકશે.

કંપની દ્વારા ૨૦૧૩ની કલમ ૯૧ તથા તેની (લીસ્ટીંગ ઓર્ગેનાઈઝેશન એન્ડ ફિક્સેટરસ રીલેવાયન્સ) રૂલ્સ ૨૦૧૫ના રજીસ્ટ્રેશન-૪૪ અંતર્ગત, કંપનીએ પોતાના સભાસદોને સભાના સ્થળ સિવાય ઈ-વોટિંગની સુવિધા ("ઈ-વોટિંગ"ની) ઉપલબ્ધ કરાવી છે. તાર.૨૪મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ કુલિયેલ દ્વારા બધા સભાસદોને તેમના નોંધાયેલ સરનામે મોકલાવેલ છે. (૨) જે સભાસદોના ઈ-મેઈલના સરનામા કંપની અથવા તે કોમ્પ્યુટરીઝી પાર્ટિસિપન્ટ્સ (DPs) પાસે નોંધાયેલ છે તેઓએ કંપનીએ ૪૪મી વાર્ષિક અહેવાલ ઈ-મેઈલ દ્વારા મોકલી આપેલ છે. (૩) ઈ-વોટિંગની મદદાન (રીમોટ ઈ-વોટિંગ) મંબળવાર, તાર.૨૪મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના સવારે ૯-૦૦ વાગ્યાથી (ભારતીય સમાનુસાર) મુજાવર, તાર.૨૪મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના સાંજના ૫-૦૦ વાગ્યા (ભારતીય સમાનુસાર) સુધી ફરી. (૪) ઈ-વોટિંગ તાર.૨૪મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના સાંજના ૫-૦૦ વાગ્યા પછી થઈ શકશે નહીં. (૫) જે વ્યક્તિના નામ કસ્ટ-ઓફ તારીખે તેવાર કરેલ સભાસદોના રજીસ્ટરમાં અથવા તે કોમ્પ્યુટરીઝીના લાભાર્થી માલિકોના રજીસ્ટરમાં નોંધાયેલ હશે તેઓ ૪ મોટર ઈ-વોટિંગ અથવા વાર્ષિક સામાન્ય સભામાં વોટિંગ કરવાને હક્કદાર રહેશે. (૬) ૪૪મી વાર્ષિક સામાન્ય સભાની નિવેદિ સીડીએસએલની વેબસાઈટ <https://www.evotingindia.com> પર પણ ઉપલબ્ધ છે.

જે વ્યક્તિઓએ સભાની નોટીસ મોકલવા કે કંપનીના રોજ ખરીદેલ હશે અને તાર.૨૦મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ કંપનીના સભાસદ હશે તેઓ Login ID અને પાસવર્ડ [helpdesk.evoting@cdslindia.com](mailto:helpdesk.evoting@cdslindia.com) પરથી મેળવી શકશે.

જેઓ ઈ-વોટિંગ બાબતે કોઈ જાણકારી મેળવી શકે અથવા તે કોઈ સવાલ હોય તેઓ <https://www.evotingindia.com> ની સાઈટના 'હેલ્પ સેક્શન' હેઠળના Frequently Asked Questions (FAQs) નો સંદર્ભ લઈને ઈ-વોટિંગ મેન્યુઅલ મેળવી શકશે અથવા તે [helpdesk.evoting@cdslindia.com](mailto:helpdesk.evoting@cdslindia.com) ને ઈ-મેઈલ કરી શકશે.

કંપની દ્વારા ૨૦૧૩ની કલમ ૯૧ તથા તેની (લીસ્ટીંગ ઓર્ગેનાઈઝેશન એન્ડ ફિક્સેટરસ રીલેવાયન્સ) રૂલ્સ ૨૦૧૫ના રજીસ્ટ્રેશન-૪૪ અંતર્ગત, કંપનીએ પોતાના સભાસદોને સભાના સ્થળ સિવાય ઈ-વોટિંગની સુવિધા ("ઈ-વોટિંગ"ની) ઉપલબ્ધ કરાવી છે. તાર.૨૪મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ કુલિયેલ દ્વારા બધા સભાસદોને તેમના નોંધાયેલ સરનામે મોકલાવેલ છે. (૨) જે સભાસદોના ઈ-મેઈલના સરનામા કંપની અથવા તે કોમ્પ્યુટરીઝી પાર્ટિસિપન્ટ્સ (DPs) પાસે નોંધાયેલ છે તેઓએ કંપનીએ ૪૪મી વાર્ષિક અહેવાલ ઈ-મેઈલ દ્વારા મોકલી આપેલ છે. (૩) ઈ-વોટિંગની મદદાન (રીમોટ ઈ-વોટિંગ) મંબળવાર, તાર.૨૪મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના સવારે ૯-૦૦ વાગ્યાથી (ભારતીય સમાનુસાર) મુજાવર, તાર.૨૪મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના સાંજના ૫-૦૦ વાગ્યા (ભારતીય સમાનુસાર) સુધી ફરી. (૪) ઈ-વોટિંગ તાર.૨૪મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના સાંજના ૫-૦૦ વાગ્યા પછી થઈ શકશે નહીં. (૫) જે વ્યક્તિના નામ કસ્ટ-ઓફ તારીખે તેવાર કરેલ સભાસદોના રજીસ્ટરમાં અથવા તે કોમ્પ્યુટરીઝીના લાભાર્થી માલિકોના રજીસ્ટરમાં નોંધાયેલ હશે તેઓ ૪ મોટર ઈ-વોટિંગ અથવા વાર્ષિક સામાન્ય સભામાં વોટિંગ કરવાને હક્કદાર રહેશે. (૬) ૪૪મી વાર્ષિક સામાન્ય સભાની નિવેદિ સીડીએસએલની વેબસાઈટ <https://www.evotingindia.com> પર પણ ઉપલબ્ધ છે.

જે વ્યક્તિઓએ સભાની નોટીસ મોકલવા કે કંપનીના રોજ ખરીદેલ હશે અને તાર.૨૦મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ કંપનીના સભાસદ હશે તેઓ Login ID અને પાસવર્ડ [helpdesk.evoting@cdslindia.com](mailto:helpdesk.evoting@cdslindia.com) પરથી મેળવી શકશે.

જેઓ ઈ-વોટિંગ બાબતે કોઈ જાણકારી મેળવી શકે અથવા તે કોઈ સવાલ હોય તેઓ <https://www.evotingindia.com> ની સાઈટના 'હેલ્પ સેક્શન' હેઠળના Frequently Asked Questions (FAQs) નો સંદર્ભ લઈને ઈ-વોટિંગ મેન્યુઅલ મેળવી શકશે અથવા તે [helpdesk.evoting@cdslindia.com](mailto:helpdesk.evoting@cdslindia.com) ને ઈ-મેઈલ કરી શકશે.

કંપની દ્વારા ૨૦૧૩ની કલમ ૯૧ તથા તેની (લીસ્ટીંગ ઓર્ગેનાઈઝેશન એન્ડ ફિક્સેટરસ રીલેવાયન્સ) રૂલ્સ ૨૦૧૫ના રજીસ્ટ્રેશન-૪૪ અંતર્ગત, કંપનીએ પોતાના સભાસદોને સભાના સ્થળ સિવાય ઈ-વોટિંગની સુવિધા ("ઈ-વોટિંગ"ની) ઉપલબ્ધ કરાવી છે. તાર.૨૪મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ કુલિયેલ દ્વારા બધા સભાસદોને તેમના નોંધાયેલ સરનામે મોકલાવેલ છે. (૨) જે સભાસદોના ઈ-મેઈલના સરનામા કંપની અથવા તે કોમ્પ્યુટરીઝી પાર્ટિસિપન્ટ્સ (DPs) પાસે નોંધાયેલ છે તેઓએ કંપનીએ ૪૪મી વાર્ષિક અહેવાલ ઈ-મેઈલ દ્વારા મોકલી આપેલ છે. (૩) ઈ-વોટિંગની મદદાન (રીમોટ ઈ-વોટિંગ) મંબળવાર, તાર.૨૪મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના સવારે ૯-૦૦ વાગ્યાથી (ભારતીય સમાનુસાર) મુજાવર, તાર.૨૪મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના સાંજના ૫-૦૦ વાગ્યા (ભારતીય સમાનુસાર) સુધી ફરી. (૪) ઈ-વોટિંગ તાર.૨૪મી સપ્ટેમ્બર, ૨૦૧૯ના સાંજના ૫-૦૦ વાગ્યા પછી થઈ શકશે નહીં. (૫) જે વ્યક્તિના નામ કસ્ટ-ઓફ તારીખે તેવાર કરેલ સભાસદોના રજીસ્ટરમાં અથવા તે કોમ્પ્યુટરીઝીના લાભાર્થી માલિકોના રજીસ્ટરમાં નોંધાયેલ હશે તેઓ ૪ મોટર ઈ-વોટિંગ અથવા વાર્ષિક સામાન્ય સભામાં વોટિંગ કરવાને હક્કદાર રહેશે. (૬) ૪૪મી વાર્ષિક સામાન્ય સભાની નિવેદિ સીડીએસએલની વેબસાઈટ [https://www.evoting](https://www.evotingindia.com)